

દાંપત્ર્ય

-હરીશંકદ

આવા વરસતા વરસાદમાં મોનાને આવેલી જોઈને માને આશ્ર્ય થયું. ‘બેટા, રીક્ષામાં તો આવવું હતું! જો ને આખી પલળી ગઈ છે.’

‘અમારી કોલેજની સામેથી તો બસ મળે છે, મા!’ પણ માની આંખ સામે આંખ મળતાં એ બોલતી અટકી ગઈ અને માની સોહમાં સરકી ગઈ. બંને વરચે કેટલોય મુક સંવાદ થઈ ગયો.

મોના ધનવાન માતાપીતાની એકની એક દીકરી. લાહકોહમાં ઉછરેલી. એક લેખક સાથે પરીયય થયો. માબાપે ઘણી સમજાવી, લેખન પર થોડો ગુજરો ચાલે? પણ કોઈનું ન સંભળતાં એ મનીષને જ પરણી. માબાપ જાણતાં કે દીકરીને પૈસાની ઘણી ખેંચ પડે છે. પણ મનીષના સ્વમાન ખાતર મોનાએ ત્રણ વરસમાં માબાપ પાસેથી એક પૈસો નહોતો લીધો. અને પોતે કોલેજમાં લેક્યુરરની નોકરી લઈ લીધી હતી.

મનીષનાં લખાણ પર એ મુગધ થઈ ગયેલી. એનું ધીરગંભીર વ્યક્તિત્વ પણ મોનાને આકર્ષણ ગયેલું. જો કે મનીષના ઘરે મોના પહેલી વાર ગયેલી, ત્યારે થોડો ગભરાઈ ગયેલી. આવા સામાન્ય મધ્યમ વર્ગના વીસ્તારમાં અગાઉ તેણે પગ નહોતો મુક્યો. પરંતુ પ્રેમના પ્રથમ ઉછાળામાં એ બધું ગૌણ બની ગયું. જો કે મનીષે પોતેય એને ઘણી વાર વારી હતી, ‘તને નહીં ફાંઝે.’ પરંતુ મોનાની હઠ હતી, ‘પણ હું કહું છું કે ધીરે ધીરે ફાંઝે જશો!’

મનીષ ખુબ પ્રેમાળ હતો, નીખાલસ હતો. મોના એના પ્રેમથી તરબોળ હતી. પરંતુ મોટે ભાગે એ પોતાની ધુનમાં રહેતો. લખવાના વીચારોમાં હોય, ત્યારે હાજર છતાં ગેરહાજર જેવો જ. ખાવા બેસે ત્યારેય ચીત એનું કલ્પનામાં સેર કરતું હોય. તેવે વખતે મોનાને જરીક મોળું મોળું લાગતુ. અને મન થતું મનીષના મોઢે સાંભળવાનું ‘આજે શાક સરસ બન્યું છે, હોં’ અથવા તો ‘મોના, આજે ફલાણું બનાવનો!’ અરે, મોના જમી કે નહીં, આજે એની તબીયત નરમ છે, એવી કોઈ વાતનું મનીષને ભાન જ નહીં. એવે વખતે મોનાને જરીક ઓછું આવી જતું.

ફરવા-કરવાનોય મનીષને જાંઝો શોખ નહીં. મોના બહુ જ કંટાળે, એકલી પહી જાય, ત્યારે એની ચોપડી-પેન ઝુંટવી લઈ બળજબરીથી એને બહાર તાણી જાય. પણ ત્યાંય મોનાનું મન કાંઈક ખાણી-પીણીમાં અને ઘરગણ્યુ વાતચીતમાં વધારે હોય. જ્યારે મનીષ પ્રકૃતીમાં ખોવાઈ જાય અથવા પોતાની નવલનાં કોઈક પાત્ર સાથે આંટો મારી આવે!

મોનાની માસીની દીકરી રતી, અમેરીકાથી ત્રણ વરસે આવી હતી. મોનાને યાદ આવ્યું, એ છોકરા સાથે પરણવા પોતાનાં માબાપે એને બહુ સમજાવેલી. મોટો ધંધો છે. અમેરીકામાં સેટલ થયેલો છે. ગર્ભશ્રીમંત કુટુંબ છે. પણ મોના નહીં માની અને માસીની દીકરી રતી સાથે એનું ગોઠવાયું.

રતી તો આવીને મોના પર ઓવારી જ ગઈ :‘તારા ઘરમાં આચ્યાથી એક ઇન્ટલેક્ટ્યુઅલ વાતાવરણમાં આવ્યા જેવું લાગે છે. ... તું ખરે જ નસીબદાર છે. ...તારા જેવી મજબુત મનની હું નહીં. તું તો માતાપીતા, સમાજ બધાની સામે થઈને તારા મનગમતા પાત્રને જ વરી. ...મનીષ પણ કેટલો પ્રેમાળ છે! ...’

‘બસ, બસ, બસ! હવે તારી વાત કર. દુનીયા આખીમાં ફરનારી તું! શું શું જોયું? ક્યાં ક્યાં રહી? તું તો મોટા ઉદ્ઘોગપતીની પત્ની !’

‘બીલકુલ બરાબર. એ ઉદ્ઘોગના પતી પહેલા. હું તો એમની દ્વીપત્ની!'-બોલતાં બોલતાં રતીનો સ્વર એટલો ખીન થઈ ગયો કે રતી ચોંકી ગઈ.

‘કેમ આવું કહે છે?’

‘મને કોઈ વાતની કમી નથી. નોકરચાકર, મોટરગાડી, ભરપુર વૈભવ, દોમ-દોમ સાંઘબી. મારે કાંઈ પણ કામ કરવાનું નહીં. શોપીંગ કરું કે કલબમાં જાઉ કે અવારનવાર પાર્ટીઓ ગોઠવું અને એમની સાથે બની-ઠનીને પાર્ટીઓમાં જાઉ. ત્યાં મોટા ઉદ્ઘોગપતીની પત્ની બનીને મહાલવાનું, ઉચ્ચ સમાજનાં માન-મરતબા મુજબ ફૂતીમ રીતે વીચારવાનું-વર્તવાનું.’

કહેતાં તો રતીની આંખમાં જળજળીયાં આવી ગયાં. મોના ઉઠીને એને માટે પાણી લઈ આવી. જરીક સ્વસ્થ થઈને રતીએ આગળ ચલાવ્યું : ‘ધરમાં જતજતનાં પકવાન થાય. પકવાન બનાવનારા અને પીરસનારા ખડે પગે હાજર. ખાનારી હું એકલી. પીરસનારા ત્રણ! એ તો સવારના જાય તે રાતે મોહેથી આવે. બપોરનું ભોજન કાયમ બહાર. રાતે પણ અઠવાડીયામાં ચાર દીવસ એમને મીટિંગોમાં કે પાર્ટીઓમાં કે પરદેશથી આવેલા મહેમાનો જોકે ઝર્છવસ્ટાર હોટેલોમાં જમવાનું હોય. ક્યારેક મને લઈ જાય; પણ ત્યાં બસ, બીજનેસની જ વાતો! હું તો બોઅર થઈ જાઉ. વીદેશ જવાનું થાય ત્યારે પણ એ તો બીજનેસમાં વ્યસ્ત, મારે એકલા એકલા ફરવાનું. મેં અમેરિકા ને યુરોપ આખું ખુંદી નાખ્યું. એ મને કદી રોકે નહીં. ગમે તેટલું હસું-ફસું, ગમે તેટલું મન ફાંચે તેમ શોપીંગ કરું, ગમે તેટલા પૈસા ખરચું. પોતે સાથે ન આવી શકે; પણ મારે માટેની વ્યવસ્થામાં જરીકે મજા ન રહેવા દે. મોના મને કશી કમી નથી, કશી નહીં!'-બોલતાં રતીનો કંઠ ફરી રુંધાઈ ગયો, આંખો ભરાઈ આવી. મોના એની પાસે જઈ એની પીઠે હાથ ફેરવવા લાગી.

રતીના ગયા બાદ મોના ક્યાંય સુધી એના જ વીચારોમાં ખોવાયેલી રહી. મનીષ હમણાં અઠવાડીયાથી એક નવા પુસ્તકના લેખનમાં હુબી ગયો હતો. અત્યારે પણ એ લખતો બેઠો હતો. મોના ક્યાંય સુધી એને જોતી બેઠી રહી. એકી ટશે એને જોતી રહી.

એકદમ એના હૈયામાં ઉમળકો આવ્યો. એ ઉઠીને મનીષના ટેબલ પાસે ગઈ. કેટલીયે વાર સુધી પાસે ઉભી રહી; પણ મનીષ લખવામાં જ મળન હતો. મોનાના દીલમાં એકદમ ભાવ થઈ આવ્યો. મનીષના માથે એણે હળવેકથી હાથ ફેરવ્યો. મનીષે ઉચે જોયું. એ નજરમાં એ જ પ્રેમ, એ જ નીમળતા, એ જ નીજાલસતા હતી, જેના પર મોના પહેલેથી વારી ગયેલી.

-હરીશ્ંક

(શ્રી. સાનીયાની મરાઠી વાતાને આધારે)

‘ભુમીપુત્ર’ પાક્ષિકના તા. ૧૬-મે, ૨૦૦૫ના અંકમાંથી, તેના સૌજન્યથી સાભાર..

સંપર્ક : c/o ‘ભુમીપુત્ર’ કાર્યાલય, હુજરાતપાગા, વડોદરા-૩૮૦૦૦૧-INDIA

સર્જક-પરીચય..

‘પણી ખબર પડી કે ‘હરીશ્ંક’ એક નહીં; પણ બે વ્યક્તિઓ છે. બનો સ્ત્રીઓ. એકનું નામ ચંદકાના, બીજનું હરવીલાસ. બનો વીનોબાની માત્ર શીખ્યા જ નહીં; તેમના સેવાયજમાં સકીય રીતે આજીવન કાર્ય કરવારી કૃતધારીણીઓ. સાહીત્યના રસને ધુંટીધુંટીને પીનારીઓ.’

-ગુલાબદાસ બ્રોકર, પુણે, ૧ ડિસેમ્બર ૧૯૮૮, ‘વીણોલાં કુલ’, ભાગ-૧૦ની પુસ્તકવનામાંથી સાભાર...



‘ભુમીપુત્રના છેલ્લે પાને પ્રગટતી ‘હરીશ્ંક’ બહેનોની સંક્ષેપ કથાઓ ગુજરાતી લેખનમાં વીશેષ ભાવે સ્થાન પામી છે. આ કથાઓ એ બહેનોની સ્વતંત્ર કૃતીઓ નથી; ભારતની વીવીધ ભાષાઓમાંથી ચુંટી કાઢેલાં કુલો તેમજે ગુજરાતી ભાષાપ્રેમીઓને ધર્યાં છે પણ એની વીશેષતા જેટલી

એના લાઘવમાં છે, એટલી જ એની જરૂર સુચકતામાં છે.... અનુવાદ તો આ છે નહીં; બધું જ નહીં સ્વરૂપ છે. નહું સ્વરૂપ આપણું; છતાં જુનું રાખવું અને પોતાની જાતને કયાંય દેખાવા ન દેવી, તે એક તપ્ય માગે છે. આવી મધુર તપ્યસ્વીતા તો બને બહેનોનાં જીવનમાં છે જ; પણ આમાં પણ એ તપ્ય ઉત્ત્યું છે.
 ‘વીનોબાળની પ્રેરજાથી લગતમગ ચીર પવાસમાં રહેનારી આ બહેનોએ દક્ષિણ-ઉત્તર-પૂર્વ-પશ્ચિમ ભારતમાંથી આ બધી વાતાઓ કેવી રીતે શોધી અને તેની પુનર્જીવન બનેએ કેવી રીતે કર્યો તે પણ એક નવાઈભરી ઘટના છે. બે જણ લખે; છતાં એક જણો, એક હાથે લઘું હોય તેવું લાગે, તે બનેનાં મનૈક્યની પ્રસાદી છે... આવી પ્રસાદી મળતી રહે અને આપણે આરોગતા રહીએ...’

--મનુભાઈનું ગોલી

લોકભારતી-સણ્ણોસરા, ૨૧-જાન્યુ. ૧૯૮૪, ‘વીજોલાં કુલ’, ભાગ-૧ની પ્રસાદવનામાંથી સામાર..

‘સંને ઈ-મહેશીલ’ -- વર્ષ: બે -- અંક: ૭૬ -- નવેમ્બર ૧૯, ૨૦૦૬

‘સંને ઈ-મહેશીલ’ માટે ‘ઉત્તમાજોહણી’ અને ‘વીજયા’ ફીન્ટ’ માં : અક્ષરાંકન: uttamgajjar@hotmail.com



આઈ ગોટ થોર બ્લડ રિપોર્ટ બેંક. આઈ એમ સોંચો, તમારા ‘બ્લડ’ માં કયાંય ‘બીજનેસ’ છે જ નહીં..., તમારા માટે ‘નોકરી’ જ બરાબર છે...!

ઈ-મેઈલ સંપર્ક: mahendraaruna@msn.com
 web site : www.ameamericanamdavadi.com